

મે 12, 2019 થી બ્રેમ્પટન ટ્રાન્ઝિટ PRESTO માં પુખ્ત ઉંમરની વ્યક્તિઓ માટે ભાડામાં ફેરફારો

પુખ્ત ઉંમરના ઉતારાઓ માટે ભાડામાં ફેરફારથી ભંડોળ સેવા સુધારાઓ અને વિસ્તરણમાં મદદ મળશે.

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 12, 2019) – કાઉન્સિલે બ્રેમ્પટન ટ્રાન્ઝિટની PRESTO સર્વિસમાં મે 12 થી શરૂ કરીને પુખ્ત ઉંમરની વ્યક્તિઓ માટે ભાડામાં ફેરફાર કરવાની ભલામણ મંજૂર કરી છે.

રોકડ ભાડું, બીજા બધાં PRESTO વર્ગીકરણો (બાળકો, જુવાનો અને વડીલો) અને GO co-fare આ ફેરફારથી પ્રભાવિત થશે નહીં.

PRESTO પુખ્ત ઉંમરની વ્યક્તિઓના ભાડામાં નીચેના ફેરફારો લાગુ થશે.

પુખ્ત ઉંમરની વ્યક્તિ	હાલનું ભાડું	મે 12, 2019
PRESTO e-Purse (પ્રવાસ દીઠ)	\$3.00	\$3.10
PRESTO અઠવાડિક પાસ	\$33.00	\$ 34.00
PRESTO માસિક પાસ	\$124.00	\$128.00

ભાડામાં ફેરફારથી વર્ષ 2019 માં \$1.1 મિલિયન જેટલી વધારાની આવક ઊભી થવાનો લક્ષ્યાંક છે અને તેનાથી બ્રેમ્પટન ટ્રાન્ઝિટને વિવિધ સેવા સુધારાઓ અને વિસ્તરણ માટે નાણાંની જોગવાઈ કરવામાં મદદ મળશે, જેમાં સામેલ છે:

- 2019 માં ફ્લીટમાં પાંચ 60 ફૂટની ક્લાસિક અને સાત 40 ફૂટની પરંપરાગત બસો ઉમેરવી.
- આ વર્ષે વધારાના 81,000 સેવા કલાકો પૂરા પાડવા.

બ્રેમ્પટનના વડીલો માટે ભાડામાં ઘટાડાઓની પ્રક્રિયા ચાલુ છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ આ વર્ષના અંતે/2020 ની શરૂઆતમાં \$15 નાં માસિક સીનિયર્સ પાસીસ શરૂ કરવા કાર્યરત છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પર વધુ માહિતી માટે, વેબસાઇટ www.bramptontransit.com જુઓ.

અવતરણ (ક્વોટ):

“અમારી અગ્રતા સુરક્ષિત અને ભરોસાપાત્ર ટ્રાન્ઝિટ સર્વિસ પૂરી પાડવાની છે. આપણી રાઈડરશિપમાં વૃદ્ધિથી, અમે અમારા રૂટ્સમાં વધારે બસો અને પુનરાવર્તન દર ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેથી અમારી સેવાનો ઉપયોગ કરતી વખતે વધારે સારો ગ્રાહક અનુભવ પૂરો

પાડી શકાય. ભાડામાં આ વધારાથી એ ખાતરી કરાવવામાં મદદ મળશે કે આપણાં પ્રવાસીઓ પાસે પોતાની રોજિંદી અવરજવર કરવામાં વધારે સારા વિકલ્પો ઉપલબ્ધ થાય.”

- એલેક્સ મિલોજેવિક (Alex Milojevic), જનરલ મેનેજર, બ્રમ્પટન ટ્રાન્ઝિટ

-30-

અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. વધુ માહિતી www.brampton.ca પર મેળવો.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca